

ત્વરિત જાહેરાત માટે

વસંત અને ઉનાળાના ઉદ્યાનો અને રિક્રિએશન કાર્યો તેમજ સ્વયંસેવકની ભૂમિકાઓ માટે સિટી ઓફ બ્રમ્પટન દ્વારા ભરતી થઈ રહી છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (23 માર્ચ 2022) – સિટી ઓફ બ્રમ્પટનમાં ઉદ્યાનો અને મનોરંજનમાં પાર્ટ-ટાઈમ રોજગાર અને શહેરભરમાં સ્વયંસેવકની ભૂમિકા મેળવવા માંગતા લોકો માટે ઘણી આકર્ષક તકો ઉપલબ્ધ છે.

### બ્રમ્પટન રિક્રિએશન

બ્રમ્પટન રિક્રિએશન પાસે આ વસંત અને ઉનાળામાં એક્ટિવિટીસ, શિબિરો, ગ્રાહક સેવા, સુવિધા કામગીરી અને અને ઘણી બધી અન્ય બાબતો માટે વિવિધ હોદ્દાઓ ઉપલબ્ધ થયા છે. સમુદાય-લક્ષી વાતાવરણમાં સહાયક ટીમ માટે કામ કરવાનો આનંદ માણો, અને ફેરફાર થઈ શકે એવા સમયપત્રક, ચૂકવણી પાત્ર તાલીમ, કૌશલ્ય વિકાસ અને પ્રગતિની તકો, છૂટો સાથેની સભ્યપદની પહોંચ અને રેઝ્યુમે પર શોભે તેવા અનુભવ જેવા લાભોનો આનંદ માણો.

એપ્રિલ 9ના રોજ થનાર રોજગાર મેળામાં ઉપલબ્ધ તકો અંગે સિટીના સ્ટાફ સાથે વાત કરો. વિગતો માટે અને અરજી કરવા [www.brampton.ca/rec-jobs](http://www.brampton.ca/rec-jobs) ની મુલાકાત લો.

### બ્રમ્પટન પાર્ક્સ મેન્ટેનન્સ એન્ડ ફોરેસ્ટ્રી

બ્રમ્પટન પાર્ક્સ મેન્ટેનન્સ એન્ડ ફોરેસ્ટ્રી આ વસંત, ઉનાળો અને પાનખરમાં વનસંવર્ધન, બાગાયત, કબ્રસ્તાન, બાંધકામ અને જિલ્લા જાળવણી ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ પાર્ટ ટાઈમ અને હંગામી ધોરણે ઉપલબ્ધ હોદ્દાઓ ધરાવે છે.

સહાયક ટીમ સાથે કાર્ય કરો, બહારના પરિસરનો આનંદ ઉઠાવો અને પોતાના કૌશલ્યોને શહેરના લાભાર્થે મોસમી મજૂર, પાર્ક કીપર, માળી, આર્બોરીસ્ટના હોદ્દાના માધ્યમથી કામમાં લાવો. વિગતો માટે અને અરજી કરવા [www.brampton.ca/employment](http://www.brampton.ca/employment) ની મુલાકાત લો.

### સ્વયંસેવક બનવાની તકો

સિટી ઓફ બ્રમ્પટન શ્રેણીબદ્ધ વિભાગો માટે સ્વયંસેવકો શોધી રહ્યા છે જેમાં સામેલ છે બ્રમ્પટન એનિમલ સર્વિસિસ, બ્રમ્પટન ઈમ્પ્રુવમેન્ટ મેનેજમેન્ટ ઓફિસ, બ્રમ્પટન રિક્રિએશન અને પર્ફોર્મિંગ આર્ટ્સ. 14 અને તેથી વધુ વયના લોકો અહીંથી વધુ જાણકારી મેળવી શકશે અને અહીં અરજી કરી શકશે [www.brampton.ca/volunteers](http://www.brampton.ca/volunteers).

**સુવાક્ષ્યો**

"બ્રેમ્પટન એક તકોથી ભરેલું શહેર છે, અને આપણા સમાજમાં રોજગાર ઊભો કરવા અમે પ્રતિબદ્ધ છીએ. અમે ઉદ્યાનો અને રિક્કિએશન માટે અમારી 2022ની વસંત અને ઉનાળાની ભરતીની ઝુંબેશ શરૂ કરી છે અને જો તમે કામ અથવા સ્વયંસેવીની શોધમાં હોવ, તો હું તમને અમારી હાલની ખુલ્લી પાડવામાં આવેલ તકો બ્રાઉઝ કરવા પ્રોત્સાહિત કરું છું."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન રહેવા, કામ કરવા અને રમવા માટેની ઉત્તમ જગ્યા છે. અમારા પાર્ક્સ કે રિક્કિએશન વિભાગોની સહાયક ટીમના ભાગ બનો અને મૂલ્યવાન કૌશલ્ય તેમજ અનુભવ મેળવો અને અમારી 2022ની તકોના માધ્યમથી સિટી સહ લાભદાયી ભૂમિકા સંપાદિત કરો.

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"આ વસંત અને ઉનાળે બ્રેમ્પટન પાર્ક્સ એન્ડ રિક્કિએશનમાં વિવિધ હોદ્દાઓ અમારી પાસે ઉપલબ્ધ છે. અમારી પાસે સ્વયંસેવકો માટેની તકો પણ છે. આપણા શહેરને સ્વસ્થ, સક્રિય અને સલામત રાખવા માટે સિટી માટેની કોઈક ભૂમિકા માટે અરજી કરશો."

- શેરમેન વિલિયમ્સ (Charmaine Williams) સિટી કાઉન્સિલર વોર્ડ 7 અને 8, ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સીટી ઓફ બ્રેમ્પટન

"સિટી ઓફ બ્રેમ્પટન એક એવી ઉત્તમ ટીમ છે જેનો ભાગ બનવાથી વૈવિધ્યસભર અને ઝડપથી વિકાસ પામતા સમાજની સેવા કરી શકાશે. આ વસંત અને ઉનાળામાં તેમજ આખા વર્ષ દરમિયાન અમે સફળ અરજદારોને આવકારવા માટે ઉત્સુક રહીશું."

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના CAO, સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિમીડિયા મિડિયા

